

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૫/૧૧/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :- સમાચાર યાદી નં.૨૨૩૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૭ કેસ કરી, ૮૦ વ્યક્તિઓને ઝડપી, ૩૨૨ લીટર દેશી દારૂ અને ૧૫૧૧ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૮,૨૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:- સમાચાર યાદી નં.૨૨૩૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૦૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૮૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:- સમાચાર યાદી નં.૨૨૩૬/૧૭

નવરંગપુરા: અલ્કાબહેન ડો/ઓ કનૈયાલાલ શાહ (ઉ.વ.૫૬) (રહે.સોનલ એપાર્ટમેન્ટ મણીનગર કો.ઓ. હાઉસીંગ સોસાયટી મણીનગર) એ તા.૪/૧૧/૧૭ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૮/૧૭ થી તા.૨૮/૮/૧૭ સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) મનમોહન (રહે. સેક્ટર ૧૦/એ, જી.આઇ.ડી.સી.ચેમ્બર્સ ઓફ કોમર્સની પાછળ ગાંધીધામ અને (૨) રણજીતસીંગ સ/ઓ શ્યામસીંગ અમીતરા (રહે, માંડેર હરદોઇ પાલી ઉત્તરપ્રદેશ) એ અલ્કાબહેનને એ/૬૦૬, સુપર લોજીસ્ટીક પ્રિમીયર હાઉસ ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે નવરંગપુરા અમદાવાદ ખાતે આવેલ સુપર લોજીસ્ટીકના નામની ઓફીસથી કન્ટેનર મોકલી આપવાની વાત કરી વિશ્વાસ અને ભરોસો આપી કન્ટેનરના ભાડાના પૈસા ઓનલાઇન મોકલી આપવા જણાવી ખાતામા ઓનલાઇન રૂપિયા ૩૫,૦૦૦/- જમા કરાવડાવી કન્ટેનર નહી મોકલી અલ્કાબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ વુ.પો.સ.ઇ.શ્રી સી.બી.રાઠોડ ચલાવે છે.

ધરફોડ:- સમાચાર યાદી નં.૨૨૩૭/૧૭

ચાંદખેડા: બિંદુ અખિલેશસિંગ રાજપુત (રહે. રામેશ્વરભાઇની ચાલી નિકોલ ગામ રોડ ઠક્કરબાપાનગર) એ તા.૪/૧૧/૧૭ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૧૦/૧૭ રાતના ૯/૩૦ થી તા.૧૬/૧૦/૧૭ કલાક ૧૦/૦૦ વાગ્યા દરમિયાન તપોવન થી ચાંદખેડા વિસત હાઇવે ફોર ડી મોલ પૂ મા સ્પોર્ટ્સ કંપનીના સ્ટોર દુકાન નંબર- ૪૮,૪૯,૫૦ તાળા ખોલી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૨,૦૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર.પટેલ ચલાવે છે.

સરદારનગર: રવિ રમેશભાઈ રાઠોડ (રહે. રમેશદત કોલોની ભીલવાસ પાણીની ટાંકી સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૩/૧૧/૧૭ રાતના ૧૦/૦૦ થી તા.૪/૧૧/૧૭ કલાક ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા તેમજ કિમતી ચીજ-વસ્તુઓ મળી કુલ રૂપિયા ૧,૩૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૨૩૮/૧૭

ઘાટલોડીયા: હાર્દિકભાઈ પ્રદીપભાઈ લાલ (રહે. મંગલમુર્તી એપાર્ટમેન્ટ નારણપુરા ટેલીફોન એક્સચેન્જની બાજુમાં નારણપુરા) એ તા.૧/૧૧/૧૭ રાતના ૧૧/૩૦ વાગે નારણપુરા ટેલીફોન એક્સચેન્જ સામે ઔષધી ઉદ્યાનની બહાર પોતાની ઈકો ગાડી નંબર જીજે ૦૧ આરઝેડ ૧૫૪૨ કિમત રૂપિયા ૧,૬૦,૦૦૦/- પાર્ક કરી હતી. જે ગાડીમાં રોકડ રૂપિયા ૧૧,૨૦૦/- રાખેલ હતા. જેની ચોરી તા.૨/૧૧/૧૭ કલાક ૭/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ હાર્દિકભાઈ લાલ એ તા.૪/૧૧/૧૭ નારોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે.

ઓઢવ: ભીમગીરી નારાયણગીરી ગૌસ્વામી (રહે. પાર્થ એપાર્ટમેન્ટ ઉત્તમનગર ૮૦ ફુટ રોડ નિકોલ) એ તા.૪/૧૧/૧૭ કલાક ૨/૦૦ વાગે શેડ નંબર-૨૨૭ નીલકંઠ ટ્રેડિંગ કંપની આગળ પોતાની આઈસર નંબર જીજે ૨૭ એક્સ ૧૮૨૧ કિમત રૂપિયા ૧૩,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી કલાક ૮/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ ભીમગીરી ગૌસ્વામીએ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.બી.વિહોલ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૨૩૮/૧૭

ઘાટલોડીયા: વિજયકુમાર કાન્તીલાલ પટેલ (ઉ.વ.૩૩)(રહે.નિલમ એપાર્ટમેન્ટ વાઘેશ્વરીરોડ ઘાટલોડીયા) એ અગમ્ય કારણસર તા.૪/૧૧/૧૭ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝુમ્મરના હુકમાં નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પ્રો.મ.સ.ઇ.શ્રી પ્રિયાંક મિશ્રા ચલાવે છે.

સરખેજ: ફરીદભાઈ હુસેનભાઈ જીવાણી (ઉ.વ.૩૮) (રહે. ચીસ્તીયાપાર્ક સોસાયટી ફેમી પ્લાઝા કોમ્પલેક્ષ સામે સરખેજ) એ અગમ્ય કારણસર તા.૪/૧૧/૧૭ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પ્રો.પો.સ.ઈ. શ્રી જી.કે.પંડ્યા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.